

(‘સન્હે મહેઝીલ’ની ઉંઝાજોહણી જોઈ ઘણા મીત્રો પુછે છે કે આ ‘ઉંઝાજોહણી’ છે શું? દરેકને અલગ અલગ લખવાને બદલે, મીત્ર બળવંત પટેલે તે વાત સંક્ષેપમાં લખી મોકલી છે તે જ રવાના કરીએ છીએ. આશા છે કે તેનાથી આધીપાતળો ખ્યાલ તો મળી જ રહેશે. પુષ્ટ સાહીત્ય પણ પ્રગટ થયું છે. રસ પડે અને વધુ આણવા મન થાય તો સરનામું મોકલજે. સાહીત્ય પાઠવીશ...ઉત્તમ...)

### ઉંઝાજોહણી

ઉંઝાજોહણી એટલે ગુજરાતી ભાષા પરીષદે (મુલે ‘ભાષા શુદ્ધીઅભીયાન’) તેના ઉંઝા અધીવેશનમાં ઠરાવ્યા મુજબ છુસ્ત અને દીર્ઘ એમ બબ્બે ‘ઈ-ઉ’ ને બદલે એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’વાળી જોહણી, જેમાં ‘ઈ’ માટે દીર્ઘ ‘ઈ’ (૩) નું વપરાતું ચીહ્ન અને ઉ માટે છુસ્ત ‘ઉ’ (૫) નું વપરાતું ચીહ્ન અપનાવવાનું ઠરાવવામાં આવ્યું તે જોહણી.

વીસમી સદીના ત્રીજા દાયકા સુધી ગુજરાતી ભાષાની જોહણીમાં એકરૂપતા ન હતી, કોઈ સર્વમાન્ય નીયમપુર્વકની વ્યવસ્થા ન હતી. આ માટેનો ઉહાપોહ નર્મદનવલરામના સમયથી ચાલતો હતો, પણ કોઈ એકમતી ઉભી થઈ શકતી ન હતી. ગાંધીજીએ ૧૯૨૮માં જોહણીના નીયમો નક્કી કરાવી ગુજરાત વીધાપીઠ દ્વારા જોહણીકોશ પ્રગટ કરાવ્યો. આ જોહણીકોશને ગુજરાતી સાહીત્ય પરીષદની ૧૯૭૯માં માન્યતા મળી અને સરકારની ૧૯૮૦માં ગુજરાત વીધાપીઠનો આ જોહણીકોશ સર્વમાન્ય થવામાં ગાંધીજીના પ્રભાવે ઘણું કામ કર્યું.

પરંતુ જોહણીના નીયમો બનાવવાથી ભાષકને સાચી જોહણી કરવાની ચાવી મળવી જોઈએ, સાચી એટલે કે માન્યજોહણી, બીનસુલ જોહણી કરવાની તેનામાં જે ક્ષમતા ઉભી થવી જોઈએ તેવું બન્યું નહીં. તેનું કારણ નીયમોની આંટીદુંટી, તેમાં ય ‘ઈ-ઉ’ ને લગતા નીયમો. આ નીયમો અંગે વીદ્ધાનો કહે છે તે પ્રમાણે:

‘તદ્દ્બબ્વ શબ્દોમાં છુસ્તદીર્ઘ ‘ઈ-ઉ’ની જોહણીને લગતા નીયમો જુઓ. આ તે તંત્ર છે કે અતંત્ર એવો પ્રશ્ન થાયા ઈ-ઉવાળા શબ્દોની અક્ષરસંખ્યા, એમાં ઈ-ઉનું સ્થાન, યુક્તાક્ષરનું સાનીધ્ય, અનુસ્વાર-નીરનુસ્વારની સ્થીતિ, અનુસ્વારની તીવ્રતા-મંદતા, મુળ શબ્દ છે કે સાધીત, નામીક રૂપ છે કે આખ્યાતીક, આ બધાં પર આધાર રાખે છે. વળી વ્યુત્પત્તિ, પ્રચલીતતા ને સ્વરભારનાં ધોરણો લાગુ પડે તે જુદાં!

‘ઈ-ઉ’ની જોહણી અંગેના આઠ નીયમો છે ને સાત અપવાદો છે અને સાત સ્પષ્ટીકરણ-નોંધો છે. જોહણીના નીયમો, ખાસ કરીને ‘ઈ-ઉ’ને લગતા, એક ઘડી પણ ચાલે તેવા નથી. સાક્ષાત બૃહસ્પતી પણ તેમાં સરળતાથી ગતી કરી શકે તેમ નથી.’

સમગ્રપણે જોતાં સ્થીતી એવી છે કે નીયમો આપણને અમુક હદ સુધી જ લઈ જાય છે; છેવટે કોશનું શરણું જ આપણે લેવાનું રહે છે. આ સ્થીતી પર શગ ચડાવે તેવી વાત એ છે કે કોશ પોતે જ પોતાના નીયમોનું ચોકસાઈથી પાલન કરી શક્યો નથી.

ભૃગુરાય અંજારીયાના શબ્દોમાં : ‘સાચી જોહણી લખવા-શીખવા- શીખવવા માગનાર માટે કોશ નથી કાનની દોરવણી રહેવા દેતો, નથી તર્કની દોરવણી રહેવા દેતો કે નથી પોતાના નીયમોની દોરવણી રહેવા દેતો.’

જોહણીની જટીલતા મોટે ભાગે છુસ્વદીઈં ‘ઈ-ઉ’ને કારણે છે. ભાષાના વીદ્વાનો અને ભાષાશાસ્ત્રીઓના મતે, ‘અવચીન ગુજરાતી ઉચ્ચારણમાં ‘ઈ-ઉ’ વગેરે સ્વરોની છુસ્વતા-દીઈતા વચ્ચેનું ભેદભાન જ નાણ થયેલું છે. અર્થબોધ માટે મોટે ભાગે સ્વરોની માત્રા-કવો-નીટી કશો ભાગ બજવતી નથી એટલે તેમની છુસ્વતાદીઈતા સુચવતાં બે લીપીયીનો બતાવવાં જરૂરી નથી.’ પંડીત બેચરદાસ દોશી, પ્રબોધ પંડીત, કે.કા. શાસ્ત્રી, દ્યાશંકર જોશી, યોગેન્દ્ર વ્યાસ, પુરુષોત્તમ મીસ્ત્રી, જ્યાંત કોઠારી અને બીજા ભાષાશાસ્ત્રીઓ પણ એક ‘ઈ-ઉ’ રાખવાના મતના છે. કે.કા. શાસ્ત્રીજીના વર્ણણ હેઠળ મળેલી ગુજરાતી સાહીત્ય પરીષદની જોહણીસુધાર સમીતીએ ૧૯૮૭માં એક જ ‘ઈ-ઉ’ રાખવાનું સુચયું હતું. પણ એ અહેવાલ કોઈ અગમ્ય કારણોસર અભરાઈએ ચહાવી દેવામાં આવ્યો.

ઘણાં વર્ષો સુધી ગુજરાતી ભાષા શીખવતા શીક્ષકો અને પ્રોફેસરોને પ્રતીત થતું રહ્યું કે વીદ્વાપીઠના નીયમો પ્રમાણેની જોહણી શીખવવામાં તેમના નીઝપુર્વકના પ્રયત્નો પરીણામકારી નીવર્દ્યા નથી અને નીયમોની આંટીઘુંટી જોતાં તે પરીણામદાયી થઈ શકે તેમ પણ નથી. તેમને લાગ્યું કે નીયમો વીશે પુનર્વીચારણા કરી નીયમો સુધાર્યા વીના ચાલે તેમ નથી. આ અંગે વીદ્વાપીઠને ઘણી વીનંતીઓ કરવામાં આવી જે બહેરા કાને અથડાઈ. આવી વીનંતી કરનાર પૈકી વરનગરના પ્રા.રામજીભાઈ પટેલ (હાલ અમદાવાદ) અગણી હતા અને તેમણે તે માટે એક ભેખધારીની જેમ પ્રયત્નો સતત ચાલુ જ રાખ્યા. પરંતુ વીદ્વાપીઠ તો એવું જકડી વલણ અપનાયું કે નીયમોમાં તો ફેરફાર થઈ જ ન શકે, કારણ કે ગંધીજીની તેના પર મહોર વાગી છે, જો કે હકીકત એ છે કે ગુજરાતી સાહીત્ય પરીષદ વીદ્વાપીઠના કોશને માન્યતા આપી ત્યારે ગંધીજીએ ખુદ જ કે.કા. શાસ્ત્રીજીને કહ્યું હતું, ‘આનાથી જોહણીસુધારાનાં દ્વાર બંધ થઈ જતાં નથી.’ વીશેષ, જોહણીકોશ તૈયાર કરનાર કાકા સાહેબ કાલેલકરે પણ કોશની પ્રથમ આવૃત્તીની પ્રસ્તાવનામાં લખ્યું છે કે, ‘એક વાર અવ્યવસ્થામાંથી વ્યવસ્થા ઉત્પન્ન થઈ ગઈ પછી સુધારા કરવા જ હોય તો તે કામ સરળ થઈ જાય છે.’ પરંતુ વીદ્વાપીઠના જોહણીકોશ વીભાગે જોહણી નીયમોની પુનર્વીચારણાનાં દ્વાર બંધ જ રાખ્યાં.

વીદ્વાપીઠ કે સાહીત્યને લગતી સંસ્થાઓ આ બાબતે કંઈ કરવા તૈયાર નથી એમ પ્રતીતી થતાં શ્રી. રામજીભાઈએ જોહણીસુધારા માટે પરીષદ ભરવાની ઝુંબેશ ઉપાડી, જેમાં તેમને સુરતના ઉત્તમભાઈ ગજીરનો પ્રબળ સાથ મળ્યો. તેમની આ વાતને જ્યાંત કોઠારી, દ્યાશંકર જોશી જેવા વીદ્વાનો, ભાષાશાસ્ત્રીઓ અને શીક્ષકોનો સારો એવો ઉમળકાભર્યો પ્રતીસાદ મળ્યો અને જાન્યુઆરી ૧૯૮૮માં ઉંઝ મુકામે આ

પરીષદ ભરાઈ. ઉંઝાની ઘણી સંસ્થાઓએ તે માટે સઘળી સગવડ કરી આપી અને આર્થિક સહયોગ પણ પુરો આપ્યો.

આ પરીષદમાં ૨૫૦ ઉપરાંત વીદ્વાનો, ભાષાશાસ્ત્રીઓ, શીક્ષકો, તંત્રીઓ, સાહીત્યકારો ઉપસ્થીત રહ્યા હતા, જેમાં ડૉ. નીશીથ ધૂવ જેવા અભ્યાસુ તબીબ અને વીપુલ કલ્યાણી જેવા પત્રકાર અને સાહીત્યના કર્મશીલ એનારાએચો પણ ઉપસ્થીત અને સક્રીય હતા.

બે દીવસની વીસ્તૃત અને સઘન ચર્ચાવીચારણાને અંતે પરીષદે સર્વાનુમતે ઠરાયું :

### ◆અખીલ ગુજરાત જોડણી પરીષદનો ઠરાવ◆

ગુજરાતીમાં ‘ઈ-ઉ’ની જોડણીના પ્રવર્તમાન નીયમો અતાકીક અને ઘણી વીસંગતતાઓથી ભરેલા છે, તેમ જ ગુજરાતી ભાષામાં ‘ઈ-ઉ’નું છુસ્વત્વ-દીર્ઘત્વ અર્થભેદક ન હોઈને એ અવાસ્તવીક પણ છે. તેથી હવે પછી તે નીયમો છોડી દેવા અને લેખનમાં સર્વત્ર એક ‘ઈ’ અને ‘ઉ’ યોજવા. ‘ઈ’ માટે દીર્ઘ ઈ (ઇ) નું અને ‘ઉ’ માટે છુસ્વ ઉ (ઉ) નું ચીહ્ન રાખવું.

(ઉંઝા: તા. ૮-૧૦ જાન્યુઆરી, ૧૯૮૮)

ઉંઝા મુકામે ભરાયેલ પરીષદમાં આ નીણ્ય થયો હોઈ આ પ્રમાણેની એક જ ‘ઈ-ઉ’વાળી જોડણી, ‘ઉંઝાજોડણી’ તરીકે ઓળખાય છે.

એ ખાસ નોંધપાત્ર છે કે જોડણીમાં એક ‘ઈ-ઉ’ માટેનો વીચાર નવો નથી. સરસ્વતીચંદના લેખક અને વીદ્વાન તથા જોગાનુજોગ ગુજરાતી સાહીત્ય પરીષદના પ્રથમ પ્રમુખ ગોવર્ધનરામ માધવરામ ત્રીપાઠીજાએ તેમ કરવા આગહપુર્વક સુચયું જ હતું. તે પહેલાં ભારતીય ભાષાઓ અને ભારતીય સાહીત્યનો વરસો સુધી જેમણે અભ્યાસ કર્યો હતો તેવા બે પ્રતીષ્ઠીત વીદેશી વીદ્વાનોએ, તેમની પણ પહેલાં કહ્યું હતું કે ગુજરાતી ભાષામાં દીર્ઘ અને છુસ્વ સ્વરોનો ભેદ રહ્યો નથી. આ વીદ્વાનો તે આર. એલ. ટનર અને લુહવીગ આલ્સ્ટોફ. વીદેશી વીદ્વાનોને બાજુએ મુકીએ તો પણ ગોવર્ધનરામ ત્રીપાઠી સરખા ધૂરંધર વીદ્વાન અને સરસ્વતીચંદ જેવી મહાનવલના રચનારનું ઉંઝાજોડણીને સમર્થન છે તે નોંધપાત્ર છે.

### નોંધ:

આ એક જ સુધારા સીવાય હાલ કોઈ જ સુધારો કરાયો નથી. બાકીના બધા જ નીયમો ગુજરાત વીદ્વાનીના ‘સાર્થ જોડણીકોશ’ મુજબ જ પળાય છે. ઠરાવ થયો તે જ દીનથી આજાંદનું ‘મધ્યાંતર’ નામક એક દેનીક અને વીસેક જેટલાં સામયીકો ઉંઝાજોડણીમાં પ્રકાશીત થાય છે. પચાસેક જેટલા લેખકોનાં સાઠેક જેટલાં પુસ્તકો એક જ ‘ઈ-ઉ’માં પ્રકાશીત થયાં છે અને દર મહીને પ્રગટતાં જાય છે. ગુજરાતીની ટેચની પ્રકાશન સંસ્થા જેવી કે ‘ઈમેજ પલ્ટિકેશન’, સુરતની ‘સાહીત્ય સંકુલ’ જેવી ઘણી પ્રકાશન સંસ્થાઓ પણ હવે ઉંઝા જોડણીમાં પુસ્તકો પ્રગટ કરે છે. અને તેથી જ આ ‘સંજે મહેશીલ’ પણ આ જ ‘ઉંઝાજોડણી’માં...

**--બળવંત પટેલ,** ગાંધીનગર

વીશેષ જાણકારી કે સ્પષ્ટતા માટે લખો:

**બળવંત પટેલ,**

ફોટોફુર્ઝ, સેક્ટર: ૨૧, 'પંચશીલ',

ગાંધીનગર-૩૮૨ ૦૨૭-ભારત

[balvantpatel@icenet.net](mailto:balvantpatel@icenet.net)

'કલાપી-વીજ્યા ફેન'માં લેખન અને 'ઉંઝોહણી'માં અક્ષરાંકન: ઉત્તમ ગજીર,

[:uttamgajjar@hotmail.com](mailto:uttamgajjar@hotmail.com)

January 26, 2006

## **"ઉંઝોહણી પરીષદ: એક દસ્તાવેજ"**

નામે ૨૦૦ પાનનો, રૂપીયા ૧૨૫ની કીમતનો, એક ઐતીહાસિક ગ્રંથ, 'ગુજરાતી ભાષાપરીષદ' તરફથી હાલ પ્રગટ કરવામાં આવ્યો છે. ૮-૧૦ જાન્યુઆરી, ૧૯૯૮ના દીવસો દરમ્યાન ઉંઝોહણી ચાલેલી પરીષદ-ચર્ચાના ઓંડીયો રેકોર્ડીંગ પરથી આ દસ્તાવેજ, છ વરસે, ભાષાપ્રેમી આદરણીય શ્રી. રતીલાલ ચંદરયાની પ્રેરણા અને આશીક સહયોગથી તૈયાર થયો. બધી બેઠકોમાંના સૌ વક્તાઓનાં મંત્ર્યો અને ચર્ચા, બેઠકાધ્યક્ષોનાં વીક્રતાપુરુષ વ્યાખ્યાનો, ભાગ લેનાર વીક્રાનોની નામાવલી વગેરે ગીકોઝીણી વીગત તેમાં આપી છે. ભાષાનાં ભાવી વિકાસ-સુધારણા માટે આ ગ્રંથ એક માર્ગદર્શિકા કેડી સમ છે. ગ્રંથ મેળવવા લખો:

**શ્રી.ઇન્ડુકુમાર જાની,**

**મંત્રી,**

'ગુજરાતી ભાષાપરીષદ',

'ખેતભવન', ગાંધી આશ્રમની બાજુમાં,

અમદાવાદ-૩૮૦ ૦૨૭-ભારત

**Shri. Indukumar Jani**

**Secretary,**

**Gujarati Bhasha Parishad,**

**'Khetbhavan' ,Near Gandhi Ashram,**

**Ahmedabad - 380 002**

**INDIA**